

બ્રેમ્પટનમાં ઈસ્ટર વીકેન્ડ 2019

બ્રેમ્પટન, ઓન્ટારિયો (15 એપ્રિલ 2019) – આ વર્ષે ગૂડ ફ્રાઈડે એપ્રિલ 19ને શુક્રવારે છે અને ઈસ્ટર મન્ડે એપ્રિલ 22ને સોમવારે છે.

પરિણામે, સીટીની ઘણી બધી સેવાઓ ઉપલબ્ધ નહીં હશે અથવા ઘટાડેલા સેવાના સ્તરે ચાલશે.

એપ્રિલ 19 થી 22 સુધી બન્ને તારીખોનો સમાવેશ કરીને એટલેકે ચાર દિવસ બ્રેમ્પટન સીટી હોલ બંધ રહેશે. આ સમય દરમિયાન નાગરિકો લગ્નના લાયસન્સની અરજી નહીં કરી શકશે, સિવિલ લગ્નની વિધિઓ બૂક નહીં કરાવી શકશે, પાર્કિંગ ફી નહીં ભરી શકશે, અથવા પરમીટ માટે અરજી કરી શકશે નહીં કે વેપારના લાયસન્સ રિન્યુ કરવા કે તેની અરજી કરી શકશે નહીં.

ઘણી બધી સેવાઓ સામાન્યપણે ચાલુ રહેશે જેમાં સામેલ છે અગ્નિશમન અને ઈમર્જન્સી સેવાઓ અને સીટી ઓફ બ્રેમ્પટન બાય લો બજવાણી.

ઈસ્ટર વીકેન્ડની પ્રવૃત્તિઓની સંપૂર્ણ સૂચિ માટે કૃપા કરીને 311 પર સર્વિસ બ્રેમ્પટનને કોલ કરો અથવા અહીં મુલાકાત લો www.brampton.ca.

બ્રેમ્પટન ટ્રાન્ઝિટ

બ્રેમ્પટન ટ્રાન્ઝિટ ઈસ્ટર વીકેન્ડ માટે નીચે આપેલ સમયપત્રક અનુસરશે.

- એપ્રિલ 19: ગૂડ ફ્રાઈડે – રવિવાર/હોલિડે સર્વિસ
- એપ્રિલ 20: શનિવાર – શનિવારની નિયમિત સેવા
- એપ્રિલ 21: ઈસ્ટર મન્ડે – નિયમિત રવિવાર/હોલિડે સર્વિસ
- એપ્રિલ 22: સ્ટર મન્ડે – નિયમિત ચાલુ અઠવાડિયાની સેવા (શાળાના રૂટ્સ બંધ રહેશે)

અમારા ટર્મિનલ્સ ખાતેના ગ્રાહક સેવાના કાઉન્ટરો ગૂડ ફ્રાઈડે અને ઈસ્ટર મન્ડેના રોજ બંધ રહેશે.

રૂટ અને સમયપત્રકની માહિતી માટે, 905.874.2999 પર કોલ કરો અથવા અહીં મુલાકાત લો www.bramptontransit.com. વાસ્તવિક સમયની આગામી બસ વિષયક માહિતી માટે અહીં nextride.brampton.ca પર જઈને તમારા સ્માર્ટફોન કે અન્ય મોબાઈલ ડિવાઈસ પર જુઓ. અન્ય પ્રવાસ આયોજનોના ટૂલ્સ માટે અહીં મુલાકાત લો www.triplinx.ca અથવા Google Maps જુઓ.

બ્રેમ્પટન મનોરંજન

રિક્રિએશન સેન્ટરો સીમીત સમયપત્રક અનુસાર ચાલુ રહેશે. ચાલુ રહેવાના કલાકો અને પ્રોગ્રામના સમયપત્રકો વિશેની અદ્યતન માહિતી માટે તમારા સ્થાનિક રિક્રિએશન સેન્ટર પેર ફોન કરો અથવા 311 પર કોલ કરો કે અહીં મુલાકાત

લો www.brampton.ca/recreation. સીટીની રિક્રિએશન એડમિનિસ્ટ્રેશન ઓફિસ ગૂડ ફ્રાઈડે અને ઈસ્ટર મન્ડેના રોજ બંધ રહેશે.

મિનિ મૂ ફાર્મ (Mini-Moo Farm) ખાતે ઈસ્ટર

ગમ્મત ભરી પ્રવૃત્તિઓ અને મફત લડાણીઓ માટે અમને આપની હાજરીનો લાભ આપો [થિંગ્કુઝી પાર્કની મિનિ મૂ ફાર્મ ખાતેની ઈસ્ટર](#) પર શનિવારે, એપ્રિલ 20ના રોજ બપોરે 1 થી 4 સુધી.

બ્રેમ્પટન એનિમલ સર્વિસિસ

બ્રેમ્પટન એનિમલ શેલ્ટર ગૂડ ફાઈડે, ઈસ્ટર સન્ડે અને ઈસ્ટર મન્ડે એટલેકે ગૂડ ફાઈડે, ઈસ્ટર રવિવાર અને ઈસ્ટર સોમવારે બંધ રહેશે. બ્રેમ્પટન એનિમલ સર્વિસિસ વિશે વધુ માહિતી માટે 905.458.5800 અથવા 311 પર કોલ કરો અથવા www.brampton.ca/animalservices ની મુલાકાત લો.

બ્રેમ્પટનનું પુસ્તકાલય

બ્રેમ્પટનની તમામ લાઈબ્રેરીની શાખાઓ ગૂડ ફાઈડે અને ઈસ્ટર સન્ડેના રોજ બંધ રહેશે. વધુ માહિતી માટે 905.793.4636 અથવા 311 પર કોલ કરો અથવા www.bramptonlibrary.caની મુલાકાત લો.

-30-

મિડિયા સંપર્ક:

મોનિકા દુગ્ગલ

કોઓર્ડિનેટર, મિડિયા એન્ડ કમ્યુનિટી એંગેજમેન્ટ

વ્યૂહાત્મક સંવાદ

સીટી ઓફ બ્રેમ્પટન

905-874-3426 | Monika.Duggal@brampton.ca